



COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં સિવિક હોલિડે 2020

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 29, 2020) – આ વર્ષે, સિવિક હોલિડે (જાહેર રજા) સોમવાર, ઓગસ્ટ 3 નાં રોજ આવે છે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે અને આપણાં રહેવાસીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે, સીટી હોલ અને સીટી ઓફ બ્રેમ્પટનની મોટા ભાગની અન્ય સગવડો, જેમાં બ્રેમ્પટન લાઈબ્રેરીની શાખાઓ સામેલ છે, આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળી શકે.

અગ્નિશમન અને કટોકટી સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ નિર્ણાયક સેવાઓનું સંચાલન આપણાં સમુદાયને ટેકો આપવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા (બ્રેમ્પટન બહારથી) 905.874.2000 નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે અથવા ઈમેઈલ સરનામું 311@brampton.ca પર ઈમેઈલ મોકલી શકે છે. પાર્ક્સમાં સુરક્ષા ઉપાયો, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું અને સગવડો બંધ થવા જેવી COVID-19 ને સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલની કોઈપણ બાબતો માટે અમે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 જુઓ.

આતશબાજી સુરક્ષા

સીટી ઓફ બ્રેમ્પટન સિવિક હોલિડે પર કોઈ આતશબાજી પ્રદર્શન કરશે નહિ અને અંગત ધોરણે આતશબાજી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

સિવિક હોલિડે વર્ષ દરમિયાનના એ ચાર દિવસો પૈકી એક નથી જ્યારે સીટી ઓફ બ્રેમ્પટનમાં અંગત આતશબાજી કરવાની છૂટ આપવામાં આવતી હોય. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/bylaws.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સિવિક હોલિડે પર રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે પણ કેટલાક રૂટ્સ રદ કરવામાં આવશે. કૃપા કરી મુસાફરી કરતા પહેલાં સમયપત્રકો તપાસો.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉનમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી 905.874.2999 નંબર પર ચાલુ અને ઉપલબ્ધ છે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.



સીટી માર્સ્ક પહેર્યો હોય તો પણ ઉતારુઓને ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને મુસાફરી કરતી વખતે, પોતાના અંગત ડિસઇન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઇઝર કે વાઇપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાર્ટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્સ્ક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઇટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

પાર્ક્સ (ઉદ્યાનો) અને રિક્રિએશન (મનોરંજન)

પાર્ક્સ અને મનોરંજન સગવડો જે ખુલ્લી અને બંધ હોય તેની યાદી માટે, [અહીં ક્લિક કરો](#).

સંપૂર્ણ બોડી સરકિટ સાથે તંદુરસ્ત રહો, ઓરિગામી હાટ્સ બનાવવાનું શીખો, રેક એટ હોમ (Rec At Home) સાથે તમારી કેલિબ્રાફી આવડતો અને ઘણું બધુંનો મહાવરો કરો, બ્રેમ્પટન રિક્રિએશન સ્ટાફે વિવિધ પ્રકારના વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સ પ્રેમપૂર્વક બનાવ્યા છે! રેક એટ હોમ (Rec At Home) પ્લેટફોર્મમાં અહીંથી પ્રવેશો, www.brampton.ca/recreation.

આ ઉનાળામાં, સીટી ઓફ બ્રેમ્પટને 4 થી 10 વર્ષની ઉંમરના બાળકો માટે સુધારેલા સમર કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ દર અઠવાડિયે, સોમવારથી શુક્રવાર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. નોંધણી કરાવવા અંગેની માહિતી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca/recreation.

બ્રેમ્પટન લાઇબ્રેરી

COVID-19 ને લીધે આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બધી લાઇબ્રેરી શાખાઓ બંધ રહેશે. [કુર્બસાઇટ પિકઅપ](#) પસંદ કરેલા સ્થળોએ ઉપલબ્ધ છે અને બધી આઠ શાખાઓમાં બાહ્ય ડ્રોપબોક્સીસ મારફતે રિટર્ન્સ 24/7 સ્વીકારવામાં આવે છે. તમને મફતમાં ઉપલબ્ધ eBooks (ઈ-બુક્સ) અને eAudiobooks (ઈ-ઓડિયોબુક્સ), એન્ટરટેઇનમેન્ટ સ્ટ્રીમિંગ, ઓનલાઇન શિક્ષણ અને ઘણું બધું [ડિજિટલ લાઇબ્રેરી](#)માંથી તમારા બ્રેમ્પટન લાઇબ્રેરી કાર્ડ નંબર અને PIN (પિન) વડે શોધી શકો. [અહીં ક્લિક કરો](#), એક ઓનલાઇન લાઇબ્રેરી કાર્ડ મેળવવા અથવા તમારા એકાઉન્ટ સંબંધિત સહાયતા માટે. બધી ઉંમરના લોકો માટેના વર્ચ્યુઅલ (વાસ્તવિક) કાર્યક્રમોમાં સહભાગી થાવ અને [સમર ક્લબ્સ માટે અહીં નોંધણી કરાવો](#): 0-12 વર્ષની ઉંમરના બાળકો માટે બ્રેમ્પટન બ્રેઇન ગેમ, ટીન સમર રીડિંગ ક્લબ, અને એડલ્ટ સમર રીડિંગ ક્લબ. [બ્રેમ્પટન લાઇબ્રેરી ઈમેઇલ અપડેટ્સ સબસ્ક્રાઇબ કરીને](#) અને બ્રેમ્પટન લાઇબ્રેરી સાથે Facebook, Twitter અને Instagram પર @bramptonlibrary જોડાઈને સંપર્કમાં રહો.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે.



એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રસ્તા પર રહે છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઇજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવા
- મરેલું પ્રાણી લઈ જવા

એનિમલ કંટ્રોલ આ સિવાયના સમયે, માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca